

## વોક-ઈન-ઈન્ટરવ્યુ

નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી ખાતેનાં આરોગ્ય કેન્દ્ર પર કરાર આધારીત મેડીકલ ઓફિસરની જગ્યા ભરવાની હોય, યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૨૧/૦૩/૨૦૨૦ ના રોજ બપોરે ૩:૦૦ થી ૫:૦૦ કલાક દરમ્યાન નિયામકશ્રી, વિદ્યાર્થી કલ્યાણ, ન.કૃ.યુ., નવસારી ખાતે પોતાની અરજી અને અસલ પ્રમાણપત્રો સાથે સ્વખર્ચે હાજર રહેવા જણાવવામાં આવે છે. અરજીપત્રક [www.nau.in](http://www.nau.in) વેબસાઈટ પરથી મેળવવાનું રહેશે.

જગ્યાનું નામ	જરૂરી લાયકાત	ફરજનો સમય	માસિક ઉચ્ચક મહેનતાણું	જગ્યાનો પ્રકાર
મેડીકલ ઓફિસર	એમ.બી.બી.એસ.	૪ કલાક/દિવસ	રૂ. ૨૮,૦૦૦/-	કોન્ટ્રાક્ટ ધોરણે
		૬ કલાક/દિવસ	રૂ. ૪૨,૦૦૦/-	૧૧ માસ માટે

તા. ૧૧/૦૩/૨૦૨૦

માહિતી/નવ/૬૧૩/૨૦૨૦

નિયામકશ્રી, વિદ્યાર્થી કલ્યાણ

આરોગ્ય કેન્દ્ર  
નવસારી કૃષિ યુનિવર્સિટી  
નવસારી ૩૯૬ ૪૫૦



તબીબી અધિકારી (કરાર આધારિત / ફીક્સ પગાર) નાં

લોક-ઈન ઈન્ટરવ્યુ માટેનું

અરજી પત્રક (પાન : ૧ થી ૩)

તાજેતર નો  
પાસપોર્ટ  
સાઇઝ ફોટો

૧.	અરજદારનું પૂરું નામ:				
૨.	પત્રવ્યવહારનું હાલનું સરનામું:				
૩.	અ. જન્મ તારીખ:				
	બ. ઉંમર:તા:૧/૦૪/૨૦૨૦ ના રોજ પૂર્ણ કરેલ વર્ષ				
૪.	પ્રતિ દિવસ ફરજ બજાવવાની તૈયારી (૧)	૪ કલાક/૬ કલાક			
૫.	શૈક્ષણિક લાયકાત : M.B.B.S. and above (with registration number)				
ક્રમ	પરીક્ષા નું નામ	યુનિ. / સંસ્થાનું નામ	પરીક્ષા પાસ કર્યાનું વર્ષ	મેળવેલવર્ગ/ ગ્રેડ/ટકા (I/II/Pass)	વિશેષ નોંધ

૬.	અનુભવની વિગત :								
ક્રમ	અનુભવવાળા હોદ્દાનું નામ	તારીખ	તારીખ સુધી	કુલ અનુભવ			બજાવેલ સેવાનો સમયગાળો		કંપની/ સંસ્થાનું નામ
				વર્ષ	માસ	દિવસ	૬ -૮ કલાકની સેવા	૬ કલાકથી ઓછા	
૭.	અન્ય સફળતા / વિશિષ્ટતા :								

### બાંહેધરી

ઉપરોક્ત તમામ વિગતો સંપૂર્ણ સાચી છે. તેમાં કોઈ પણ પ્રકારની ભુલનો અવકાશ નથી. આમ છતાં ઉપર જણાવેલ કોઈ માહિતી ખોટી પુરવાર થશે તો મારી ઉમેદવારી/ પસંદગી/ નિમણૂક રદ થવાને પાત્ર રહેશે, જે અંગે હું કોઈપણ પ્રકારનો હક્ક દાવો કરીશ નહીં.

સ્થળ:

સહી:

તારીખ:

પુરૂ નામ:

કરાર આધારીત / ફીક્સ પગાર થી નિમણુંક થનાર તબીબી અધિકારી માટેની શરતો:

૧. અરજદારની જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, અનુભવ વગેરેના જરૂરી પ્રમાણિત કરેલ પ્રમાણપત્રોની નકલનો સેટ, નિયત અરજી પત્રક સાથે જોડવાનો રહેશે. ઈન્ટરવ્યુ દરમ્યાન અસલ પ્રમાણપત્રો ચકાસણી માટે બતાવવાનાં રહેશે.
૨. અરજદારે સ્વખર્ચે ઈન્ટરવ્યુ માટે નિયત સ્થળે તથા સમયે હાજર થવાનું રહેશે.
૩. સદરહું નિમણુંક ફક્ત કામચલાઉ અને ૧૧ માસ માટે આપવામાં આવશે.
૪. નવસારી કૃષિ યુનિવર્સિટી કરાર આધારીત/ફીક્સ પગાર થી પસંદગી પામેલ તબીબી અધિકારીને નિયમિત કર્મચારી તરીકે નિમણુંક આપવા બંધાતી નથી તથા કરાર આધારિત પસંદગી પામેલ ઉમેદવાર યુનિવર્સિટીના નિયમિત કર્મચારી ને મળતા લાભોનો કોઈ પ્રકારનો દાવો કરી શકશે નહીં.
૫. નિમણુંક કરતા અધિકારી, જરૂર જણાય તો વહીવટી કારણોસર કે અન્ય રીતે, પસંદગી પામનાર ઉમેદવારને કોઈપણ જાતની નોટીસ કે વળતર વગર છુટા કરી શકશે.
૬. કરાર આધારીત / ફીક્સ પગાર થી પસંદગી પામેલ તબીબી અધિકારીએ એક સપ્તાહમાં હાજર થવાનું રહેશે. હાજર નહિ થનાર ઉમેદવારની નિમણુંક આપોઆપ રદ થયેલ ગણાશે.
૭. અરજી કરનાર ઉમેદવાર ને ગુજરાતી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે.
૮. સામાન્ય સંજોગોમાં કરાર આધારીત તબીબી અધિકારીએ પોતાની સેવાઓ રવિવાર તથા જાહેર રજાઓ સિવાય નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના આરોગ્ય કેન્દ્ર ખાતે આપવાની રહેશે.
૯. આકસ્મિક સંજોગો / ઈમરજન્સી કેઈસમાં મુકરર કરેલ સેવાના સમય સિવાય પણ પરિસ્થિતિને આધિન સારવાર આપવાની રહેશે.
૧૦. પસંદગી પામેલ સદરહું તબીબી અધિકારીએ તેમના નિવાસસ્થાનેથી નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના આરોગ્ય કેન્દ્ર ખાતે જવા આવવાની સગવડ પોતાની રીતે કરવાની રહેશે. તે માટે યુનિવર્સિટી તરફથી કોઈ વાહનની સગવડ કરવામાં આવશે નહીં. આકસ્મિક સંજોગો/ઈમરજન્સી કેઈસમાં જરૂર પડ્યેથી ઉપલબ્ધ યુનિવર્સિટી વાહનનો ઉપયોગ કરી શકશે.
૧૧. આ સિવાય યુનિવર્સિટી તરફથી વખતો વખત જારી કરવામાં આવતા નિયમો અથવા હુકમો સદરહું તબીબી અધિકારીને બંધનકર્તા રહેશે.
૧૨. આ નિમણુંક સંબંધિત સેવાઓ અંગે વાદ-વિવાદ કે અન્ય બાબતે નિર્ણય લેવાનો અધિકાર નીચે સહિ કરનારનો અબાધિત અને આખરી ગણાશે જે નિમણુંકદારને બંધનકર્તા રહેશે.
૧૩. પસંદગી પામેલ સદરહું તબીબી અધિકારી તરીકેની પોતાની સેવા ચાલુ રાખવા માંગતા ના હોય તો તે અગાઉ તેમણે યુનિવર્સિટીને પંદર દિવસ પહેલા જાણ કરવાની રહેશે.  
ઉપર જણાવેલ તમામ શરતો મને માન્ય છે.

સ્થળ:

તારીખ:

સહી:

પુરૂ નામ: